

CIN : L17120GJ2008PLC053464

E-mail: info@shahlon.com

Web : www.shahlon.com

May 27, 2023

To,
The Manager
Dept. of Corporate Services
BSE Ltd.
25th Floor, P.J. Towers,
Dalal Street,
Mumbai - 400001

Sub: Advertisement in Newspapers under Regulation 47 of SEBI (Listing

Obligation and Disclosure Requirements) Regulations, 2015.

Ref: Shahlon Silk Industries Ltd. (BSE Script Code: 542862)

Dear Sir,

With regard to subject, we attached herewith Newspaper Cutting for the advertisement published in 'Gujarat Guardian' and 'The Financial Express' publication dated 27/05/2023 in the matter of **Publication of Audited Financial Results** for the quarter and year ended on 31st March, 2023.

Kindly update this information on your website for investors/general public.

Tel.: +91 261 2635551 - 53

Fax: +91 261 2635550

+91 261 4190200

Thanking you.

For, Shahlon Silk Industries Limited

Hitesh K. Garmora

Company Secretary

અરજદારઃ **દૃષ્ટિ અલ્કેશકુમાર પટેલ** રહે. દેલવાડા, તા. વાલોડ, જી. તાપી. **વિરૂદ્ધ** અરજદારના વિ. વ. **શ્રી સ્મિતા પટેલ**

સામાવાળાઃ ૧) પ્રિન્સીપાલશ્રી, કન્યા વિદ્યાલય, અસ્તાન, સરદાર બાગ, તા. બારડોલી-૨, જી. સુરત. ૨) જીલ્લા શિક્ષણ અધિકારી, જીલ્લા પંચાયત કંચેરી, સુર્રત. ઃ **જાહેર નોટીસ**ઃ

આથી આ જાહેર નોટીસ આપી જુણાવવામાં આવે છે કે, ઉપરોક્ત અરજદારનું નામ એલ.સી. માં Patel Drashtibo Ashishbhai લખાયેલ છે, જે ખોટુ હોય તેના બદલે Patel Drastiben Ashishbhaiમુજબનો સુધારો કરવા હાલની અરજી Ashishibila વર્ગાવલ છે, કે વધુ હાવ લેવા બેઠલ Falei Diasuben Ashishibilan કુકવાલ ધુનારા કરવા હાવેલા બેરહ અત્રેની કોર્ટમાં આપેલ છે. સદરહું અરજીની સુનાવણી તા. ૧૫-૦૬-૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦ વાગ્યે રાખવામાં આવેલ છે. જે કોઈ ઈસમ્

તથા સરકારી, અર્ધ સરકારી, પેઢી, મંડળી, વ્યક્તિ, કંપની, સ્વાયત સંસ્થા વિગેરને સદરહું અરજા વિગ્રુપ્ય હોય હોય તો જાતે અગર યોગ્ય માહીતગાર કરેલ વકીલ મારકતે અત્રેની કોર્ટમાં અચુક હાજર રહેવા નોંધ લેશો. જો તેમ કરવામાં કસુર કરશો તો કાયદા અન્વયે યોગ્ય તે હુકમ કરવામાં આવશે. જેની નોંધ લેવી. આજ તારીખઃ ૧૯ મી મે સને ૨૦૨૩ ના રોજ મારી સહી તથા કોર્ટનો સિક્કો કરી આપ્યો.

તૈયાર કરનાર મુકાબલ કરનાર (સહી/-) (સહી/-) (શે. છે. પટેલ) (શે. છે. પટેલ) (શે. છે. પટેલ) (સેલ્કો) ન્ટ - સીવીલ કોર્ટ - બારડોલી સુપ્રિન્ટેન્ડન્ટ સીવીલ કોર્ટ - બારડોલી

વેચાણ અંગેની જાહેર નોટીશનો જાહેર જવાબ

જત હમારા અસીલ યુસુફ સાલેહ તે ખતીજા અહમદ સાલેહ ભીખુના સીધીલીટાન વારસદાર નાઓની સુચર્ના અને ફરમાઈશ અન્વયે જાહેર જનતાને જણાવવાનું કે તા. ૨૫-૫-૨૦૨૩ ના રોજ દૈનિક વર્તમાનપત્ર ગુજરાત ગાર્ડિયનમાં પાના નં. ૪ ઉપર વકીલશ્રી દિપાલી આર. પટેલનાઓ દ્વારા નીચે જણાવેલ મિલકત અંગે વેચાણ સંબંધી એક જાહેર નોટીસ તેમના અસીલ એવા કહેવાતા બોગસ અને ખોટા વારસદાર ઝોહરાબીબી અહમદ સાલેહ ભીખુની પુત્રી તે અહમદ ઈકબાલની પત્નીનાઓ દ્વારકા આપવામાં આવેલ છે. અને તેઓ હમારા કુટુંબની કોઈ વ્યક્તિ કે કોઈ સીધી કે આડી લીટીના વારસદાર નથી. અને સરખા નામોનો ગરલાબ ઉઠાવી તેઓ સદર જમીન ખોટી રીતે વેચાણ કરવાની પેરવી કરી રહેલ છે. અને સદર જમીન સંબંધી હમો જમીનના સીધીલીટીના વારસદારોએ કોઈને પણ પાવર ઓફ એટર્ની આપેલ નથી કે આ જમીન હાલે હમો વેચનાર નથી. તેમ છતાં કેટલાક લોકો હમો વિદેશ (સાઉથ આફ્રિકા) રહેતા હોય અને જમીનની વારસાઈ બાકી હોય ખોટી જાહેરાત કરી આ જમીન વેચાણ સંબંધી કાર્યવાહી કરી રહેલ છે. જેથી જાહેર જનતાને જણાવવાનું કે, આ જમીન સંબંધી કોઈએ કોઈપણ જાતની જમીન ટ્રાન્સફરને લગતી કે નાણાંકીય લેવડ-દેવડ કોઈપણ વ્યક્તિ સાથે કરવી-કરાવવી નહીં. જો કોઈ વ્યક્તિ આવું કોઈ કૃત્ય કરશે-કરાવશે કે તેમાં સહભાગી બનશે તો તેમને કોઈ રાઈટ ટાઈટલ પ્રાપ્ત થશે નહીં. ઉલ્ટાનું આવું ગેરકાયદેસરનું કૃત્ય કરનાર અને તેમાં મદદરૂપ થનાર વ્યક્તિ વિરૂધ્ધ હમારા અસીલ કાયદેસરની કાર્યવાહી કરશે. જેની જાહેર જનતાએ ગંભીર નોંધ લેવી. ઃ મિલકતનું વર્ણન ઃઃ

ડી. નવસારી, સબ-ડી. જલાલપોર, મોજેઃ ટંકોલી ગામે આવેલ ખેતીની જમીન

ખાતા	જુનો બ્લોક	નવો બ્લોક	ક્ષેત્રફળ	આકાર
નંબર	નંબર	નંબર	હે. આરે. ચો. મી.	રૂા. પૈસા
102	૧૬૩	७३	1-92-60	21.90

હમારી સુચના મુજબ

નસીલ મજકુરની સુચના અને ફરમાઈશ અન્વયે તા. ૨૬-૦૫-૨૦૨૩ સમીર વાંચ. શેખ (એડવોકેટ) મેઈન રોડ, નવસારી, તા. જી. નવસારી. મો: 99797 31543 ૦૧, ત્રીજો માળ, ઓમ આર્કેંડ, જુન

એલએલપી એક્ટ, ૨૦૦૮ ની ક્લમ ૧૩(૩), એલએલપી રૂલ્સ, ૨૦૦૯ ના રૂલ્સ ૧७ સાથે વાંચતા કંપની રજીસ્ટર્ડ ઓફિસને એક રાજ્ય માંથી બીજા રાજ્યમાં સ્થળાંતર કરવા માટે અખબારમાં પ્રસિધ્ધ કરવાની જાહેરાત

કેન્દ્ર સરકાર, વેસ્ટર્ન રિજિયન સમક્ષ… એલએલપી એક્ટ, ૨૦૦૮ ની કલમ ૧૩(૩)ની બાબતમાં એલએલપી અધિનિયમ,૨૦૦૮ એલએલપી રૂર્લ્સ,૨૦૦૯ ના રૂલ્સ ૧७ સાથે વાંચતા

યશ ટેક્ષફેબ એલએલપી તેની રજિસ્ટર્ડ ઓફિસ : એફ-૨/૩, નવાપુર એમઆઈડીસી, નવાપુર ઈન્ડસ્ટ્રીયલ એરીયા, નવાપુર, નંદુરબાર, મહારાષ્ટ્ર –૪૨૫૪૧૮ ની બાબતમાં....

આથી સામાન્ય જનતાને સૂચના આપવામાં આવે છે કે એલએલપી એ એલએલપી એક્ટ. ૨૦૦૮ ની કલમ ૧૩ હેઠળ કેન્દ્ર સરકારને અરજી કરવાની દરખાસ્ત કરે છે અને તારીપ ૧૫ મે, ૨૦૨૩ ના ચેજાચેલી બોર્ડ મીટીંગમાં એલએલપી ને તેની રજિસ્ટર્ડ ઓફિસને 'ગુજરાત રાજ્ય'' માંથી ''મહારાષ્ટ્ર રાજ્ય''માં બદલવા માટે સક્ષમ કરવા પસાર કરવામાં આવેલા વિશેષ ઠરાવના સંદર્ભમાં પુરક કરારમા ફેરફારની પુષ્ટિ માંગે છે

એલએલપી ના રજિસ્ટર્ડ ઓફિસના સુચિત ફેરફારથી જેનું હિત પ્રભાવિત થવાન શક્યતા છે તે કોઈપણ વ્યક્તિ તેના/તેણીના હિતની પ્રકૃતિ અને એફિડેવિટ દ્વારા સમર્થિત તેના/તેણીનાં વાંઘાઓ રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા પહોંચાડી શકે છે. યશ ટેક્ષફેબ એલએલર્પ ના વિરોધના આધારો અરજદાર કંપનીના નિમ્ન લિખિત રજિસ્ટર્ડ ઓફિસના સરનામે એક નકલ રવાના કરવા સહિત, આ સૂચના પ્રસિધ્ધ થયાની તારીખથી દિન ૧૪ મ

આર્ચા એ-૧૦૨, પૂણ્યભૂમિ, ભગવાન મહાવીર કોલેજ પાસે, બીજો વીઆઈર્પ રોડ, વેસુ, સુરત

ચશ ટેક્ષફેબ એલએલપી, માટે અને વતી, ડિરેક્ટર, નામ : સુનીલ કુમાર ગર્ગ.

તારીખ : ૨७/૦૫/૨૦૨૩, સ્થળઃ સુરત



અમરોલી શાખા

134-135, જીવન જ્યોત સોસાયટી, નવો કોસાડ રોડ, સુરત, ગુજરાત-395006 કોન : 8355829041, ઇમેઇલ : ubin0829048@unionbankofindia.com

ડિમાન્ડ નોટીસ (સરફેસી એક્ટ, 2002ના સેક્શન 13ના સબ સેક્શન (2) અંતર્ગત)

ા. શ્રીમતી પુનમ ગણેશ માલી (કરજદાર, મોર્ટગેજર અને મૃતક કરજદાર સ્વ. ગણેશ પંઢરીનાથ માલીના

A-504, બિલ્ડીંગ નં. A , ઓમકાર રેસીડેન્સી , ફૃતિ રેસીડેન્સી પાછળ , કોઝવે લિંક રોડ , સિંગણપોર સુરત-395004. <u>અને અહીં પણ :</u> સ્વ. ગણેશ પંઢરીનાથ માલીના પત્ની : પોસ્ટ નંદાને , તા. ધુળે , નંદાને ,

ઘળે . મહારાષ્ટ-424307 . માસ્ટર સ્વરાજ ગણેશ માલી (સગીર) (મૃતક કરજદાર નામે ગણેશ પંઢરીનાથ માળીના કાનૂની વારસદાર અને તેમના કુદરતી વાલી અને માતા નામે શ્રીમતી પુનમ ગણેશ માલી દ્વારા) A-504, બિલ્ડીંગ નં A, ઓમકાર રેસીડેન્સી, કૃતિ રેસીડેન્સી પાછળ, કોઝવે લિંક રોડ, સિંગણપોર,

સુરત-395004. અને અહીં પણ : સ્વ. ગણેશ પંઢરીનાથ માલીના પુત્ર : પોસ્ટ નંદાને , તા. ધુળે , નંદાને , ઘુળે, મહારાષ્ટ્ર-424307.

વિષય : અમારી અમરોલી શાખામાંથી આપને આપવામાં આવેલી કેડિટ સુવિદ્યાઓ સંદર્ભે એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ દ્વારા કાર્યવાહી નોટીસ પાઠવવામાં આવી .એનપીએ તરીકે વર્ગીકૃત જાહેર કરેલ છે . અમારે તમને જણાવવાનું છે કે તમારા એકાઉન્ટ/એકાઉન્ટ્સ નામે **ગણેશ પંઢરીનાથ માલી અને પૂનમ ગણેશ** માલી દ્વારા અમારી શાખામાંથી નીચેની ક્રેડિટ સુવિધાઓનો લાભ લીધો છે.

મંજૂર મર્ચાદા (રૂપિયામાં) હાલનો ત્યાજ દર ખાતા નંબર 290416650000065 12,96,000.00 હાઉસીંગલોન 9.10% વધુમાં , અમારે તમને જણાવવાનું છે કે તમારુ ખાતુ એટલે કે , **ગણેશ પંઢરીનાથ માલી અને પુનમ ગણેશ માલી** દ્વારા બાકીની બાકી રકમ/ઇન્સ્ટોલમેન્ટ/વ્યાજની યુક્વણી કરવામાં તમે ડિફોલ્ટ કર્યું છે તેથી તા.22-02-2023 ના રોજ તમારા એકાઉન્ટને NPA એકાઉન્ટ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે .

તારીખના રોજ, રૂા. 13,51,988. 50 (રૂપિયા તેર લાખ એકાવન હેજાર નવ સો અઠ્યાંસી રૂપિયા અને પયાસ પૈસા

વિગત	રકમ (રૂપિથામાં)
NPA ની તારીખ એટલે કે , 22-02-2023 બેલેન્સ દર્શાવતા ખાતામાંથી અર્ક મુજબ બાકી બેલેન્સ (23-01-2023 સુધીના વ્યાજ સહિત).	13 ,20 ,691 .50
તા.24-01-2023 થી તા.30-04-2023 સુધી લાગુ ન થયેલ વ્યાજ	31,296.00
તા.24-01-2023 થી તા.30-04-2023 સુધી પેનલ વ્યાજ	1.00
રિકવરી	(0.00)
કલ બાકી રકમ	13.51.988.50

અમારી વારંવારની માંગણીઓ છતાં, તમે બધા, કરજદાર/જમીનદાર/મોર્ટગેજર હોવાને કારણે, લોન ખાતાઓમાં બાકી રહેલી રકમની કુલ રકમ ચૂકવવામાં નિષ્ફળ ગથા અને કરાર આદારિત જવાબદારીઓનું નિકાલ કરવામાં પણ ઉપેક્ષા કરી અને ડિફોલ્ટ થથા છો. બેંકની જાણકારીમાં એવું આવ્યું છે કે શ્રી ગણેશ પંઢરીનાથ માલી તા.01-10-2022 ના રોજ અવસાન પામ્યા

છે. તમે, નંબર 1 કરજદાર કર્મ મોર્ટગેજર છો અને નંબર 2 ના કુદરતી વાલી પણ છો અને મૃતક કરજદાર રત. શ્રી ગણેશ પંઢરીનાથ માલીના કાયદેસરના વારસદાર પણ છો એટલે કે , સ્વ. શ્રી ગણેશ પંઢરીનાથ માલીના વ્યવસાય અને જામીનગીરીઓ વારસામાં મેળવી છે . તેથી , તમે , કરજદાર કમ મોર્ટગેજર છો અને નંબર 2 ના કુદરતી વાલી પણ છો અને મૃતક કરજદાર શ્રી ગણેશ પંઢરીનાથ માલીના કાયદેસરના વારસદાર હોવાને કારણે , શ્રી ગણેશ પંઢરીનાથ માલીની ઉપરોક્ત જવાબદારીઓ અને બાકી લેણાં નિકાલ કરવા માટે જવાબદાર છો.

આથી તમોને સિક્ચરીટાઈઝેશન એન્ડ રીકન્સ્ટક્શન ઓક કાઈનાન્સીયલ એસેટસ એન્ડ એન્કોર્સમેન ઓફ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ એક્ટ , 2002ના સેક્શન 13(2) હેઠળ રૂા.13,51,988.50 (રૂપિયા તેર લાખ એકાવન **હજાર નવ સો અઠ્યાંસી રૂપિયા અને પચાસ પૈસા પુરા)** તા .30-04-2023 સુધીના વ્યાજ સહિત તથ તા.01-05-2023 થી લાગુ ન કરાચેલ વ્યાજ (જો કોઈ હોય તો) , કોસ્ટ , એક્ષપેન્સીસ અને આગળનું વ્યા તમારા દ્વારા થયેલા કરારેબદ્ધ શરતો અને વિગતો મુજબ છે. જે આ નોટીસ પ્રસિદ્ધ થયેથી 60 દિવસમાં તમામ બાકી લેણાં ભરપાઈ કરી દેવા , જો આમ કરવામાં નિષ્ફળ જશો તો અમે નીચે જણાવેલી મિલકત બેંકની તરફેણમાં તથા જણાવેલ કાયદાઓ હેઠળના તમામ હક્કો દ્વારા અમલમાં મુકવા માટે ફરજ પાડીશું .

મિલકતની વિગત

તમામ ભાગ અને હિસ્સા સહિત ફ્લેટ નં .504 ,પાંચમો માળ ,અંદાજીત માપ 650 ચો .કુટ ચાને 60.39 ચો . સુપર બિલ્ટ અપ એરિચા અને 36.99 ચો.મી. બિલ્ટ અપ એરિચા , જમીનમાં અવિભાજીત હિસ્સા સાથે સ્ક્રીમ નં. 26 (સિંગણપોર), ફાઈનલ પ્લોટ નં. 30, માપ 1280 ચો.મી., સિંગણપોર, સિટી સુરત. જે મિલકતની ચતુર્સિમા ઃ પૂર્વ ઃ સરકારી સ્કૂલ, પશ્ચીમ ઃ ફાઈનલ પ્લોટ નં. 25 અને 43ની જમીન, ઉત્તર ટી.પી.રોડ, દક્ષિણ ઃ ફાઈનલ પ્લોટ નં. 38ની જમીન. મિલકતના માલિક ઃ શ્રીમતી પુનમ ગણેશ માલી અને શ્રી ગણેશ પંઢરીનાથ માલી.

l) મહેરબાની કરી નોંધ લેશો કે જો તમે 60 દિવસમાં આ રકમ ભરપાઈ કરવામાં નિષ્ફળ ગયા તો , બેંક કાયદાના તમામ હક્કો હેઠળ પગલા લઈ જો સુરક્ષિત અક્સ્થામતોનું વેચાણ દ્વારા પણ બાકી લેણાં સંતોષકારક રીતે ન ભરપાઈ થયા તો અમોને તમારી પાસેથી બાકીની રકમ ની વસુલી માટે તમારી સાથે કોર્ચના કાયદા/ડેબ્ટ રીકવરી ટ્રીબ્યુનલ કાયદાકીય પગલાં લેવાની ફરજ પડશે. 2) તમને વિનંતી કરવામાં આવે છે કે કલમ 13(13) કાયદા હેઠળ, આ નોટીસ મળ્યા બાદ બેંકની જાણ

બહાર અહીં જણાવેલ મિલકતનો ફક્ત ઘંધાના સામાન્ય કામકાજ માટેના ઉપયોગ સિવાય આ મિલકતનો નિકાલ અથવા વેચાણ કરી શકશો નહીં. નોંધ લેશો કે આ કાયદાના ઉલ્લંઘન કરશો તો ગંભીર પરિણામ ભોગવવં પડશે. 3) તમને જણાવવામાં આવે છે આ નોટીસનું ધ્યાન આકૃષ્ટ કરવામાં આવે છે તે જણાવેલ સમય મર્ચાદામાં

સેક્શન 13ના સબ સેક્શન (8) હેઠળ તમો તમારી સુરક્ષિત મિલકતની બાકી લેણા ભરપાઈ કરી પાછી મેળવી શકો છો. l) મહેરબાની કરીને નોંધ લો કે આ સૂચના પ્રાપ્ત થયા પછી, તમે અધિનિયમની કલમ 13(13) ની

શરતોમાં લેખિતમાં અમારી પૂર્વ સંમતિ વિના વેચાણ , ભાડા પેટે અથવા અન્થથા ઉપર ઉલ્લેખિત કોઈપણ सुरक्षित संपत्तिने स्थानांतरित કरशो नहीं.

આપનો વિશ્વાસ તા. 02-05-2023 | સ્થળ : સુરત. મુખ્ય પ્રબંધક, અધિકૃત અધિકારી

સૂરતપીપલ્સબૅન્કનાશતાબ્દીવર્ષની ઉજવણી:'કર્માધીન'નાટકરજૂકરાયું

દેશમાં યોજનાર ઐતિહાસિક માટે બેંકના ગ્રાહકો, સભાસદો, શુભલ્કો G-20 સમિતિના કાર્યક્રમ અંતર્ગત તેમજ સ્ટાફનો આભાર માન્યો હતો. સૂરત પીપલ્સ કો-ઓ. બેંકે તેના કાર્યક્રમમાં ઉપપ્રમુખ સુનિલ મોદી, શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે ડિરેક્ટરો જ્યવદન બોડાવાલા, મુકેશ તેના સ્ટાફ તેમજ ભૂતપૂર્વ સ્ટાફ માટે ગજ્જર, સંજીવ તમાકુવાળા, ક્રિપ્નલ સહપરિવાર કરંજીયા-આર્ટ દિગ્દર્શિત જરીવાલા, જસ્મીન મેહતા, કેતન મોદી નાટક 'કર્માધીન'નું અયોજન કર્યું હતું. તેમજ એમ.ડી. જતિન નાયક અને જેમાં અતિથિ વિશેષ તરીકે સુરતનું અસી. જનરલ મેનેજર સુનિલ કાપડીયા ગૌરવ એવા પદ્મશ્રી યશદી કરંજિયા તેમજ વિવિધ સહકારી બેંકના પ્રમુખો, ઉપસ્થિત રહ્યા હતા. બેંકના પ્રમુખ મુકેશ ડિરેક્ટરો હાજર હતા.

Be a step ahead in life CIN - L65110TN1921PLC001908

શાખા મુજબ.

હરાજીનું સ્થળ

ઓલપાડના ડેવિશ પટેલને ચેકરિટને કેસમાં ૧ વર્ષની સજા TMB Tamilnac Mercantile Bank Ltd

સંબંધીના નાતે ધંધા માટે આપેલા રૂ.૪.૫૭ લાખના ચેક રિટર્ન કેસમાં ઓલપાડના ડેવીશ પટેલને ચોથા એડીશ્નલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ચિરાગ રાણાએ તકસીરવાર ઠેરવી ૧ વર્ષની સાદી કેદ અને રૂ.પ.પ૦ લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. કતારગામ ખાતે રહેતા સંજય

ભરત પ્રજાપતિ પાસેથી ડેવીશ જીવરાજભાઇ પટેલ(રહે. ઓલપાડ, કુમકુમ બંગ્લોઝ)એ સંબંધીના નાતે ધંધા માટે રૂ.૪.૫૭ લાખ માગ્યા હતા. વાયદા પ્રમાણે સંજયભાઈએ ઉછીના આપેલા નાણાની માગણી કરી હતી. જેથી ડેવીશ પટેલે ચુકવણી પેટે રૂ.૪.૫૭ લાખના બે ચેક આપ્યા હતા. જે ચેક બેંકમાં વટાવતા રિટર્ન થયા હતા. જેથી સંજય પ્રજાપતિએ એડવોકેટ રમેશ વી. સાનેપરા અને નયન માવાણી મારફતે ડેવીશ પટેલ સામે ચેક રિટર્નની ફરિયાદ કરી હતી. ચોથા એડીશ્નલ ચીફ્ર જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ચિરાગ રાણાએ ડેવીશ પટેલને આ કેસમાં તકસીરવાર ઠેરવી ૧ વર્ષની સાદી કેદની સજા અને રૂા.૫,૫૦ લાખનો દંડનો હુકમ કર્યો હતો.

Change Of Name

, Mitaliben Chetan Patel

residing at 8615 avenue Stuart, apt. 2, Montreal, Quebec, H3N 2S4, Canada, have changed my name and shall hereafter be known as

Mitali Patel.

તારીખઃ ૨૬.૦૫.૨૦૨૩ ्री वैंक ऑफ़ बड़ीदा अબ्रामा शाजा, अબ्रामा, ता.डामरे॰,

દકાન નં-બી-૧૦૮. પશ્ચિમઃ પ્રતિક રેસીડેન્સી

बैंक ऑफ़ बड़ीदा अબ्रामा शाजा, अબ्रामा, ता.डामरे॰, Bank of Rayoda ७, सरत-३०४१६० औ Bank of Baroda । अति : abrsur@bankofbaroda.com

લિંકનો સંદર્ભ લો.

સ્થળ : સુરત

લેણદારને નોટીસ (જે સરફેસી એક્ટ, 2002ના કલમ 13ના પેટા વિભાગ (2) હેઠળ) શ્રી લાલજીભાઈ જીવરાજભાઈ બુહા, શ્રીમતી રસીલાબેન લાલજીભાઈ બુહા 14 , બાલકૃષ્ણ સોસાચટી , વેલેજા , ઉમરા ગામ , સુરત-394130 .

સંદર્ભ:એમારીઅબ્રામાશાખા,સુરતસાથેક્રેડિટસુવિધા. અમારા મંજૂરી પત્ર નં. BOB/ADV, તા. 04-05-2019નો સંદર્ભ લઈએ છીએ જેમાં આપનું એડવાન્સ એકાઉન્ટ શ્રી બુહા લાલજીભાઈ જીવરાજભાઈ (કરજદાર), શ્રીમતી રસીલાબેન લાલજીભાઈ બુહા (સહ-કરજદાર), આપે વિવિધ ક્રેડિટ સુવિધાઓ અને મંજૂરીની શરતોની મંજૂરી આપવામાં આવી છે. ઉપરોક્ત મંજૂરીના અનુસંધાનમાં તમે

વ્યાજનો બાકી રકમ તા. 14-03-2022 સિક્યોરિટીઝના ટૂંકા લીમીટ સુધી (તા.11-03-2023 વર્ણન સાથે સીક્યોરીટી સુવિદ્યાનો પ્રકાર (લાખમાં) 53 सुधीना व्याष सहित) 용된된 જણાવેલ મિલકતનું ઈક્વીટેબલ મોર્ટગેજ્ બરોડા હોમ લોન ઈન્સ્ટ્રુમેન્ટ ઓફ ડિપોઝીટ દ્વારા ટાઈટલ ડીડ (ટોપ-અપ હાઉસીંગ લોન) રૂા.10.99 + તેના પ્ર રૂા.13.00 8.70% વ્યાજ અને વ્યાજ રિવર્સલ dl.11-07-2019. 51950600000656 યાઈડ રજી. નં. 10023 સબ **૨જીસ્ટાર** સરત 3ા.10.99 + તેના પર (ઓલપાડ), જીં.સુરત વ્યોજ અને વ્યાજ રિવર્સલ મોર્ટગેજ કરેલ મિલકતની

ધરાણ સુવિધાઓનો લાભ લીધો છે અને તેના માટે સુરક્ષા પ્રદાન કર્યા પછી તેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે, જેમ

પછીથી જુંશાવ્યું છે. વિવિધ લોન/ક્રેડિટ ફેસિલિટી ખાતાઓમાં વર્તમાન બાકી છે અને આવી જવાબદારી માટે બનાવેલ

વિગત નીચે મુજબ **મોર્ટગેજ કરેલ મિલકતની વિગત** : તમામ ભાગ અને હિસ્સા સહિત સ્થાવર મિલકત પ્લોટ નં. 14, (કેજેપી પ્રમાણે બ્લોક નં. 165/14 માપ 47.39 ચો.મી.) યાને 56.66 ચો.યાર્ડ યાને 510.00 ચો.ફ્રુટ, "બાલકૃષ્ણા રો-હાઉસ", બ્લોક નં. 165, રેવન્યુ સર્વે નં. 166 અને 172/2, મોજે ગામ ઉમરા, તા. ઓલપાડ, જી. સુરત. કથિત મિલકતર્ના યતુર્સિમા : પૂર્વ : પ્લોટ નં .17, પશ્ચિમ: લાગુ સોસાયટીનો આંતરિક રસ્તો, ઉત્તર : પ્લોટ નં .13, દક્ષિણ : પ્લોટ નં .15.

2) <mark>તા.04-05-2019 ના રોજના સ્વીકૃતિના પત્રમાં તમે બેંક પ્રત્યે તમારી **રૂ.10.99 લાખ, તા.11-03-2**023ન</mark> રોજ ની જવાબદારી સ્વીકારી છે. ઉપર જ્ણાવેલ બાકી રકમમાં વધુ ડ્રોઇંગ અને તા.11-03-2023 સુધીનું વ્યાજ + તેના પરનું વ્યાજ + વ્યાજ રિવર્સલ, ખાતામાંથી ડેબિટ કરાયેલ અન્ય શુલ્કનો સમાવેશ થાય છે ર) જેમ તમે જાણો છો, તમે તા.12-10-2022 ના રોજ પૂરા થયેલા મહિના માટે ઉપરોક્ત લોન/બાકીના વ્યાજની ચુકવણીમાં ડિફોલ્ટ્સ કર્યા છે. તમે ટર્મ લોન√ડિમાન્ડ લોનના હપ્તાઓની ચુકવણીમાં પણ ડિફોલ્ટ થયા છો જે

તા.12-10-2022 અને તે પછી ચૂકવણી માટે બાકી છે. ક) તમારા હારા બાકી રકમની ચુકવાણી રુવામાં કસુર થઈ હોવાથી તમારા લોન એકાઉન્ટ ભારતીય રીઝર્વ બેંકના નિયમે અને માર્ગદર્શિક પ્રમાણે તા.29-12-2022 (NPA તરીકે વર્ગીકરણની તારીખનો ઉલ્લેખ)ના રોજ નોન પર્ફોર્મીંગ્

એસેટ્સ તરીકે જાહેર કરવામાં આવેલ છે. અમારી વારવારની વિનંતીઓ અને માંગણીઓ હોવા છતાં તેના પર વ્યાજ સહિતની ભાકી રકમની ચુકવણી કરી નથી.) ઉપરોક્ત ફકરા 1માં ઉલ્લેખિત વિવિધ સિક્યોરીટીઝ દ્વારા મેળવેલ ક્રેડિટ સુવિધાઓના સંદર્ભમાં તમારી જવાબદાર્ર

પુરી પાડવામાં અસમર્થ નિવક્ષા હોવાથી અને તમારા એકાઉન્ટના નોન પર્ફોર્મીંગ એસેટ્સ તરીકે વર્ગીકત કરવામાં . માવ્યા હોવાથી અમે અહીં તમને સિક્યુરીટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાઈનાન્સીયલ એસેટ્સ એન્ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ એક્ટ 2002ની કલમ 13ની પેટા કલમ (2) હેઠળ તમને નોટીસ આપીને ઉપરોક્ત કંકરા 1માં જણાવેલ બેંકની બાકી રકમ રૂ. 1.0,99,000.00 લાખ(રૂપિયા દસ લાખનંવ્વાણુ હજાર પુરા) અને તેના ઉપરનું વ્યાજ્ +વ્યાજ રિવર્સલ +એન્ય ચાર્જીસ આ નોટીસ પ્રાપ્તીથી 60 દિવસની અંદર ચુકવીને તમને નાણાકીય જવાબદારીઓ અદા કરવાનું જણાવવામાં આવે છે. અમે તમને વધુમાં નોટીસ આપી જણાવીએ છીએ કે ચુકવણી તારીખ સુધી વ્યાજ સહિતની બાકીની રકમ ચુકવણીમાં કસુર થશે તો ધારાની કલમ 13ની પેટા કલમ 4 હેઠળના તમામ કે કોઈસત્તાનો ઉપયોગ કરવાની અમને ફરજ પડશે જેની નોંધ લેવા વિનંતી. 5) મહેરબાની કરીને નોંધ લેવી કે, પુરી રકમ ચુકવવામાં નહીં આવે તો ત્યાં સુધી દરેક ક્રેડિટ સુવિધા માટે ફકરા-1માં

ે જણાવ્યા પ્રમાણે દરે વ્યાજ ચઢવોનું ચાલુ રહેશે. 7) અમે તમારું ધ્યાન આ ધારાની પેટા કલમ 13 તરફ દોરીએ છીએ. જેની પરીભાષાઓ તમારી પર ફકરા-1માં જુણાવેલ વેચાણ, લીઝ કે અન્ય રીતે સુરક્ષિત નામાંતરણ કરવાનો તમારા પર પ્રતિબંધ મુકવામાં આવે છે (સામાન્ય વ્યવસાય સિવાય). જેના માટે અમારી પૂર્વ મંજૂરી લેવાની રહેશે. વધુમાં એવું જણાવીએ છીએ કે આ ધારાની કલમ 13(13)માં જણાવ્યા પ્રમાણેની જોગવાઈઓનું પાલન ન કરવું એ આ ધારાની કલમ 29 હેઠળ દંડનીય અપરાધ છે.

) અમે તમને જણાવીએ છીએ તમારું ધ્યાન કલમ 13ની પેટા કલમ 8 તરફી દોરીએ છીએ જેમાં સુરક્ષિત મિલકત જે ટાંચમાં લીધેલી છે તમામ બાકી રકમ, તમામ ખર્ચાઓ સહિત બેંકની બાકી છે તે કોઈપેલ સમયે અથવા જાહેરાતમાં પ્રસિદ્ધ થયેલ તારીખના પહેલા જાહેર હરાજી/ક્વોટેશન મંગાવીને/ટેન્ડર મંગાવીને કે ખાનગી રાહે સોદો કરીને આવી સુરક્ષિત મિલકત રીડીમ કરાવી શકશે. એ વાતની નોંધ લેશો કે ઉપર મુજબ નોટિસ જાહેર થયાના સુરક્ષિત મિલકત રીડીમ કરવાનો તમારી પાસે કોઈ અધિકાર રહેશે નહીં.) કૃષા કરીને નોંધ લેશો કે આ નોટીસ કોઈપણ પ્રકારના પુર્વગ્રહ વગર આપવામાં આવેલ છે અને અમાર

અમર્યાદિત અધિકાર કે ઉપાયના માંડવાળ તરીકે ગણવામાં આવશે તેથી આ અંગે વધુ માંગ કરીશું જ્યાં સુધી પુરે પુરી રકમ ચુકવાઈ ન જાય. આપનો વિશ્વાસુ, અધિકૃત અધિકારી. સ્થળ : અબ્રામા | તા. 14-03-2023

ઉર્ષિતા પટેલ ડિન્સ ઓફ ઓનલ એવાર્ડથી સન્માનિત સુરતઃ કુ. ઉર્ષિતા પટેલ એ BBA

(કોમ્યુનિકેશન મેનેજમેન્ટ) ડિગ્રી સાથે સ્નાતક કર્યું. તથા તમામ સેમેસ્ટર માટે 'ડિન્સ ઓફ ઓનર' એવાર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે

જાહેર નોટીસ

આથી લાગતા-વળગતા તમામને હાલની આ જાહેર નોટીસથી જણાવવાનં કે, મોજે દેવધા, તા. ગણદેવી, જી. નવસારી મુકામે મંદિર ફળીયામાં આવેલ ગામતળની જમીન પર ચાલી

આવેલ ગ્રામ પંચાયત રેકર્ડ દફતરે ગ્રામ પંચાયત ઘર નં. ૩૩૪ થી નોંધાયેલ મિલકત

૧) નિલેશભાઈ ભાણાભાઈ પટેલ તથા ૨) જીતેશભાઈ ભાણાભાઈ પટેલ ના સંયુક્ત નામે

ચાલી આવેલ છે. તેઓ તમામ સદર મિલકત ઉપર તેઓ રાષ્ટ્રીયકૃત બેંકમાંથી લોન મેળવવા

માટે અરજી કરેલ છે. ઉપર જણાવેલ વર્ણન અને વિગતવાળી મિલકત અન્વયે હમારી પાસે

ટાઈટલ ક્લીયર સર્ટીફીકેટ મેળવવા માટે તમામ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરેલ છે. ઉપર

જણાવેલ મિલકતમાં કોઈપણ ઈસમના ખાધાખોરાકી યા લીંયનનાં હકકો યા ઈઝમેન્ટનાં

હકકો સંસ્થાનાઓ, સહકારી, સરકારી કે ખાનગી બેંકોનો હકક, હિત, અધિકાર સમાયેલા

હોય તો તે આ નોટીશ પ્રસિધ્ધ થયાના દિન-૧૦ માં જે તે વાંધા, હરકત, હકક, હિત,

અધિકાર સંબંધે પુરાવા સહિત લેખીત રજુઆતો હમોને નીચે જણાવેલ સરનામે રજુ કરવી,

જો નિયત સમયમાં કોઈપણ પ્રકારની રજુંઆતો કરવામાં નહિં આવશે તો મુદત વિંતે હમો

૧) નિલેશભાઈ ભાણાભાઈ પટેલ તથા ૨) જીતેશભાઈ ભાણાભાઈ પટેલ ના નામે ટાઈટલ

કલીયર સટીફીકેટ ઈસ્યુ કરીશું ત્યારબાદ ઉપરોક્ત જણાવેલ મિલકત અંગે ભવ્યિમાં

મિલકતનાં ટાઈટલ અંગે કોઈની કાંઈપણ તર-તકરાર તથા વાંધા-વચકા ચાલશે નહીં. જેની

અસીલ મજકુરની સુચના અને કરમાઈશ અન્વયે, તા. ૨૬-૦૫-૨૦૨૩ **સંજય શ્રીનિયાસ પ્રદ્યાન** (એડવોકેટ એન્ડ નોટરી) ૧૦૮, વ્યંક્ટેશ્વર એપાર્ટમેન્ટ, ડીસ્ટ્રીક્ટ કોર્ટની સામે, જુનાથાણ, નવસારી. મો: 98259 80755

પ્રોગ્રામમાં તમામ સત્રમાં શ્રેષ્ઠ એકેડમિક દેખાવા માટે સિલવર મેડલ પણ એનાયત કરવામાં

આથી જાહેર જનતાએ ગંભીર નોંધ લેવી.

પ્લોટ નં. ૨૫/સી, ૨૫/ડી અને ૨૫/ઈ ગ્રાઉન્ડ ફ્લોર, અનિમેશ હાઉસ,

ย์-มิย์ด : surat_ringroad@tmbank.in, รูโด : ๐२۶٩- २३۶۶५๐๐, २३۶७۶๐๐

પ્લોટનં. ૨૫/સી, ૨૫/ડી અને ૨૫/ઈ, ગ્રાઉન્ડ ફ્લોર, અનિમેશ હાઉસ, કીન્નરી સીનેમા,

રીંગ રોડ શાખા, સુરત - ૩૯૫૦૦૨, ગુજરાત. email:-surat_ringroad@tmbank.in, Phone No.0261- 2366500, 2367600

તમિલનાડ મર્કેન્ટાઇલ બેંક લીમીટેડ

ક્લિરી સીનેમાં, રીંગરોડ શાખા, સુરત-૩૯૫૦૦૨, ગુજરાત

હરાજી નોટિસ સ્થાવર મિલ્કતોની વેચાણ માટે

સિક્યુરિટાઈઝેશન એન્ડ રિકન્સ્ટ્રકશન ઓફ ફાઈનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઈન્ટરેસ્ટ એક્ટ

૨૦૦૨ સાથે સિક્યુરિટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) અધિનિયમ, ૨૦૦૨ની ક્લમ ૮ (૬) અને ૯(૧) ની જોગવાઈઓને વંચાણે લેતાં

આથી જાહેર જનતાને જણાવવાનું કે, વર્ણવેલ જે કરજદાર મેસર્સ <mark>ભાવના ટેક્સટાઈલ, પ્રોપ્રાઈટ્રીક્સઃ શ્રીમતી વદાસિચા ભાવનાબેન</mark>

હરસૂખભાઈ, જે વઘાસિયા હરસૂખભાઈ લાલજીભાઈના પત્ની અને જામીનદાર શ્રી વઘાસિયા હરસૂખભાઈ લાલજીભાઈ, જે વઘાસિયા

લાલજીભાઈના પુત્ર જામીનદાર શ્રી શુમ્મર નરેશભાઈ લીરૂભાઈ, જે દીરૂભાઈ લખમણભાઈ શુમ્મરના પુત્ર ની જંગમ / સ્થાવર મિલકતો જે

ગીરો / ચાર્જ / હાઈપોથેકેટેડ તરીકે મુકેલા સુરક્ષીત મીલકતનો રચનાત્મક કબજો તામિલનાડ મર્કન્ટાઈલ બેંક રીંગરોડ શાખા (સુરક્ષિત

લેણદાર)નાં અધિકૃત અધિકારીએ લીધો છે; જેનું વેચાણ ''જ્યાં છે, જેમ છે'', ''જ્યાં છે જે છે'' અને ''જ્યાં પણ જે કંઈપણ છે''ના આધાર પર

સદર નીચે દર્શાવેલી તારીખ: ૧૯.૦૬.૨૦૨૩ નીચે દર્શાવેલ રૂા.૧,૦૫,૮૯,૧૧૫.૫૧ (અંકે રૂપિયા એક કરોડ પાંચ લાખ નેવ્યાસી હજાર

એક્સો પંદર અને એકાવન પૈસા પુરા) તા. ૩૦-૦૪-૨૦૨૩ મુજબ બાકી નીકળતા ખર્ચ જે તામિલનાડુ મર્કન્ટાઇલ બેંક લિમિટેડ, રીંગરોડ

૧. હરસુખભાઈ લાલજીભાઈ વઘાસીયાના નામે રહેલ કોમર્શિયલ બિલ્ડીંગ શોપ નં. બી-૧૦૯, ક્ષેત્રફળ ૪૧૮.૦૦ ચો. મી. અથવા ૩૮.૮૪

ચો.મી.(સુપર બિલ્ટ અપ એરિયા) અને ૨૬૪.૫૮ચો. ફૂટ અથવા ૨૪.૫૯ ચો.મી. (બિલ્ટ અપ એરિયા) અને તેનો કાર્પેટ એરીયા ક્ષેત્રફળ

૨૪૭.૫૮ ચો. ફ્ટ અથવા ૨૩.૦૧ ચો. મી. બિલ્ડીંગ નં. બી, પ્રથમ માળે. ''માર્ક પોઈન્ટ'' જેનો ફાઇનલ પ્લોટ નં. ૧૭૨, ટી.પી સ્ક્રીમ નં.

૬૯ (ગોડાદરા-ડિંડોલી) બ્લોક નં. ૨૦૩, રેવન્યુ સર્વે નંબર ૧૨૮/૨ ગામ ઃ ડિંડોલી, સબ જિલ્લો સુરત સીટી, જિલ્લો સુરત ખાતે આવેલ

જમીન અને અવિભાજિત હિસ્સાના સમાન ગીરો સાથે બાંધવામાં આવેલ મિલકત. **ચતુર્સીમાઃ** દક્ષિણઃ દાદર, ઉત્તરઃ દુકાન નં.-બી-૧૧૦, પૂર્વઃ

હરસુખભાઈ લાલજીભાઈ વઘાસીયાના નામે રહેલ કોમર્શિયલ બિલ્ડીંગ શોપ નં. સી-૦૨૧, ક્ષેત્રફળ ૭૦૦.૦૦ ચો. મી. અથવા ૬૫.૦૫

ચો.મી.(સુપર બિલ્ટ અપ એરિયા) અને ક્ષેત્રફળ ૩૮૬.૦૬ ચો. ફુટ અથવા ૩૫.૮૮ ચો.મી. (બિલ્ટ અપ એરિયા) અને તેનો કાર્પેટ એરીયા

ક્ષેત્રફળ ૩૭૮.૮પ ચો. ફૂટ અથવા ૩૫.૨૧ ચો. મી. બિલ્ડીંગ નં. સી, ગ્રાઉન્ડ ફલોર "માર્ક પોઈન્ટ" જેનો ફાઇનલ પ્લોટ નં. ૧૭૩, ટી.પી

સ્ક્રીમ નં. ૬૯ (ગોડાદરા-ડિંડોલી) બ્લોક નં. ૨૦૪, રેવન્યુ સર્વે નંબર ૧૨૮/૧, ગામ : ડિંડોલી, સબ જિલ્લો સુરત સીટી, જિલ્લો સુરત ખાતે

વેચાણના વિગતવાર નિયમો અને શરતો માટે કૃપા કરીને સુરક્ષિત લેણદારોની વેબસાઇટ (www.tmb.in) પર આપેલી

સંદર્ભ : અમારી અબ્રામા શાખા, સુરત સાથે ક્રેડિટ સુવિધા.

(લાખમાં)

31.12.25

સી.ઓ.પી., ઉત્તર: પ્લોટ નં. 92, દક્ષિણ: પ્લોટ નં. 94.

તા. 17-06-2022 અને તે પછી ચૂકવણી માટે બાકી છે.

8.35%

53

અનામત કિંમત મિલકત નં. ૧ માટે રૂા. ૧૦,૮૦,૦૦૦/- અને અર્નેસ્ટ મની ડિપોઝીટ રૂા. ૧,૦૮,૦૦૦/-,

અનામત કિંમત મિલકત નં. ૨ માટે રૂા. ૨૬,૬૦,૦૦૦/- અને અર્નેસ્ટ મની ડિપોઝીટ રૂા. ૨,૬૬,૦૦૦/- રહેશે.

આવેલ મિલકત. **ચતુર્સીમા** ઃદક્ષિણઃ પેસેજ, ઉત્તરઃ દુકાન નં. સી-૨૨, પૂર્વઃ દુકાન નં-સી-૨૦, પશ્ચિમઃ સીડી

નીચે મુજબ છેઃ

સુવિદ્યાનો પ્રકાર

બરોડા હોમ લોન

195060000032

કુલ

તમિલનાડ મર્કન્ટાઇલ બેંક લિ.

રીંગરોડ શાખા

બેંકમાં મુકેલી સ્થાવર સંપત્તિની હરાજી દ્વારા વેચાણ અંગેની હરાજી નોટિસ.

હરાજીનું વેચાણનું તારીખ અને સમય ૧૯.૦૬.૨૦૨૩ અને બપોરે ૧૨.૩૦ કલાકે

રાષ્ટ્રીયસ્વયંસેવકસંઘનાસંઘશિક્ષાવર્ગનો આજે સુરતમાં સમાપન સમારોહ યોજાશે મુસ્ત, તા.રક પાટિયા નજીકની એસયુવી સ્કૂલમાં સાંજે સંઘ સતત ૯૮ વર્ષથી રાષ્ટ્રીય ચેતના

સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત ૬.૦૦ કલાકે આયોજીત સમારોહમાં જાગરણ અને સંગઠીત સમાજશક્તિના પ્રાંત સંઘ શિક્ષા વર્ગ (પ્રથમ વર્ગ) સહજાનંદ ગૃપ ઓફ કંપનીઝના ચેરમેન નિર્માણનું કાર્ય કરે છે. કાર્યકર્તાના સુરતના સમાપન પ્રસંગે આવતીકાલે ધીરજલાલ કોટડિયા અને વકતા તરીકે પ્રશિક્ષણ માટે દર વર્ષે સંઘ શિક્ષા વર્ગનું

ર્શનિવાર તા.૨૭મીના રોજ સાર્વજનિક ડો.સુનિલ બોરીસા હાજરી આપશે. આયોજન કરવામાં આવે છે. આ વર્ષે વર્ગાધિકારી મનસુખ પન્નાના આપણે ત્યાં પ્રથમવર્ષ સંઘ શિક્ષા વર્ગનું

કામરેજ-કડોદરા હાઈ-વેના વલથાણ જણાવ્યાં મુજબ રાષ્ટ્રીય સ્વયંસેવક સમાપન જવા થઈ રહ્યું છે. કામરેજ-કડોદરા હાઈ-વે વલથાણ પાટીયા નજીકથી એસયુવી સ્કૂલમાં આયોજન

torrent POWER

વીજપ્રવાહ બંધ રહેવા બાબત

ગ્રાહકોને ગુણવત્તાસભર વીજપુરવઠો આપવાના હેતુથી નીચે દર્શાવેલ સબસ્ટેશનોના નેટવર્ક મેઈન્ટેનન્સનું આયોજન કરેલ છે. આ સબસ્ટેશનોમાંથી વીજપુરવઠો મેળવતા ગ્રાહકોનો સવારના ૯:૦૦ થી સાંજના ૫:૦૦ કલાક દરમ્યાન વીજપુરવઠો બંધ રહેશે. અનુસૂચિત સમય પહેલા વીજપુરવઠો પુનઃકાર્યરત કરવા માટે અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું.

૨૯/૦૫/૨૦૨૩, **સોમવાર** : એસ.એમ.સી. સાયન્સ સેન્ટર (HT),

સ્વામિનારાયણ નં.-૨ (પી.કે. રોડ), અજન્તા ડાયમન્ડ ઇન્ડ. નં.1-T2, વિશ્વકર્મા આર્કેડ, ઇન્દ્રપ્રસ્થ (સગરામપુરા)

વિવેકાનંદ (કરંજ), ડાયમન્ડ ટ્રેડ સેન્ટર, ડાયમન્ડ વિલેજ-SS-T2

૩૦/૦૫/૨૦૨૩, મંગળવાર : ત્રિનિધિ (ઘોડદોડ), સી.જે. એક્ષપોર્ટ (એ.કે. રોડ),

૩૧/૦૫/૨૦૨૩, બુધવાર : જે.સી.મોદી એક્ષપોર્ટ, સેન્ટ્રલ વેર હાઉસ (વરાછા), એમ.ડી. ટાવર નં.૨ (વરાછા). હોટેલ ઈએલ મેગ્નીફિકો

ઃ રોયલ ઇન્ડ.નં.-૨ (વેડ રોડ), કુબેર પાર્ક (વેડ રોડ) ૦૧/૦૬/૨૦૨૩, ગુરૂવાર કે.જી. જીઆઇડીસી ઇન્ડ.નં.૧૭. સિધ્ધિવિનાયક (રસ્તમપુરા)

આનંદ નિવાસ (સલાબતપુરા) 0૨/૦૬/૨૦૨૩, **શકવાર**: વેન્કટેશ્વર ઇન્ડ. નં.1-T1, અભિનંદન માર્કેટ નં.૨,

મણિભદ્ર (ઉમરા), વિભા આર્કેડ (ચૌટા બઝાર), પચ્ચીગર જેમ્સ (અલમીરાણ)

o૩/o∉/૨૦૨૩, શનિવાર : તાપી એન્ક્લેવ ૦૪/૦૬/૨૦૨૩, રવિવાર : બોમ્બે માર્કેટ નં.૩ (પી.કે. રોડ)-SS-T2

> અસુવિધા બદલ દિલગીર છીએ અમારી WhatsApp <mark>સેવા, આપને વધુ સુવિધા</mark>

8141970070 પર 'Hi' લખી મોકલાવો પાવર, બીલ, અન્ય જાણકારી તથા ચૂકવણી કરો WhatsApp @ 8141970070

હેલ્પ લાઈન નં. 19128 (Toll Free) / 0261-2551912 / 9099991912 પોર્ટલ : connect.torrentpower.com અને મોબાઈલ એપ : Torrent Power Connect

શાહલોન સીલ્ક ઈન્ડસ્ટ્રીઝ લિમીટેડ કોર્પોરેટ ઓફિસઃ ત્રીજા માળે, દાવર ચેમ્બર્સ, સબજેલ નજીક, રીંગ રોડ, સુરત ૩૯૫૦૦૨

CIN: L17120GJ2008PLC053464 ટેલી નં. +૯૧–૨૬૧–૪૧૯ ૦૨૦૦ 🛊 ક્ષઃ +૯૧–૨૬૧–૨૬૩ ૫૫૫૦ Website: www.shahlon.com ૩૧ માર્ચ ૨૦૨૩ ના રોજ સમાપ્ત થયેલા ત્રીમાસીક અને વાર્ષિક સમયગાળાના

		ઝિમાઝીક	સમચગાળા	વર્ષની સમાપ્તી		
ક	વિગત			34/03/2022		
H	143161	1000		0.01		100
		(ઓડીટેડ)	(અનઓડીટેડ)		(ઓડી	
٩	સંચાલન માંથી કુલ આવક (ચોખ્ખી)	45560.66	4369.60	G443.00	30666.05	39336.29
5	સમયગાળા દરમિયાનનો ચોખ્ખો નફો / (ખોટ) (કરવેરા પહેલા, અપવાદીત વસ્તુઓ પહેલા)	85.63	46.89	835.05	-60.89	464.46
3	કરવેરા પહેલાના સમયગાળા દરમિયાનનો ચોખ્ખો નફો / ખોટ (અપવાદીત વસ્તુઓ પછી)	64.63	46.89	835.05	494.3 6	464.46
8	કરવેરા પછીના સમયગાળા દરમિયાનનો ચોખ્ખો નફો / (ખોટ) (અપવાદીત વસ્તુઓ પછી)	33.43	405.85	290.66	366.66	390.03
ч	સમયગાળાની કુલ વ્યાપક આવક (સમયગાળા દરમિયાનનો વ્યાપક નફો/(ઓટ) (કરવેરા પછી) અને અન્ય વ્યાપક આવક (કરવેરાપછી)	60.65	405.85	585.88	835.00	386-80
ç	ઇક્વીટી શેર કેપીટલ (પ્રતિ શેર રૂા.૨/– ની મૂળ કિંમત)	9665.04	૧ ७८५.०૫	9665.04	9665.04	9065.04
9	ભંડોળ (ગયા વર્ષની ઓડિટેડ પાકા સરવૈયા માં દર્શાવ્યા મુજબ પૂન:મુલ્યાંકિત ભંડોળ બાદ કરતા)				663A153	6534.66
c	શેર દીઠ આવક (પ્રત્યેક શેર રૂા.૨/– મુજબ) (સતત અને બંધ કામગીરી માટે)					
	મૂળ કિંમત	0.08	0.99	0.58	0.85	0.39
	ઘટાડેલી કિંમત	0.08	0.99	0.28	6.85	0.39

નાવઃ 4. ઉપરોક્ત પરિણામોંની ઓડિટ કમીટી દ્વારા સમીક્ષા કરવામાં આવી છે અને ત્થારબાદ તા રકમી મે ૨૦૨૩ ના રોજ મળેલી બોર્ડ ઓફ કાયરેક્ટર્સની મીટીંગમાં મંજુરી આપવામાં આવી હતી.

રાજ મળતા ખાંડ આફ ડાયરક્રવાના માટેલા માનુરા આપવાના આવા દિવા. દે. 34મી માર્ચ, રુવરંડ ના રોજ સમાપ્ત થતા ત્રીમાસીક અને વાર્ષિક નાણાદિય પરિણામોની વિગતવાર માહિતી, સેબી (લીસ્ટીંગ ઓબ્લીગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રીક્વાથરમેન્ટ્સ) નિયમો, ૨૦૧૫ ના નિયમ ૩૩ મુજબ સ્ટોક એસ્ટ્રોબ્જમાં ફાઇલ કરવામાં આવેલ છે, કે જેનો સાર ઉપર આપ્યો છે. નાણાક્રિય પરિણામોની સંપૂર્ણ માહિતી સ્ટોક એસ્ટ્રોબ્જની વેબસાઇટ (www.bseindia.com) પર તથા કંપનીની વેબસાઇટ (www.shahlon.com) પર ઉપલબ્ધ છે. શાહલોન સિલ્ક ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ

खाः सरत

અધિકૃત અધિકારી,

વર્ણન સાથે સીક્યોરીટી

용된된

જણાવેલ મિલકતનું ઈક્વીટેબલ મોર્ટગેજ

dl.19-08-2017.

સબ રજીસ્ટાર સરત

વિગત નીચે મુજબ

આપનો વિશ્વાસુ, અધિકૃત અધિકારી.

ઈન્સ્ટ્રુમેન્ટ ઓફ ડિપોઝીટ દ્વારા ટાઈટલ ડીડ

વાઈડ રજી. નં. 7430

(પલસાંશા)ે, જૉ.સુરત

મોર્ટગેજ કરેલ મિલકતની

તમિલનાડ મર્કેન્ટાઇલ બેંક લિ.

અમદાવાદ રીજનલ ઓફિસ

(રીંગરોડ શાખા માટે)

લેણદારને નોટીસ (જે સરફેસી એક્ટ, 2002ના કલમ 13ના પેટા વિભાગ (2) હેઠળ)

શ્રી નરલાલ તુલસીરામજી સુથાર અને શ્રી કિશનલાલ તુલસીરામ સુથાર પ્લોટ નં. 93, ઉમા વિહાર બંગ્લોઝ, દસ્તાન રેલવે ફાટક પાસે, બારડોલી રોડ, સુરત-394006.

અમારા મંજૂરી પુત્ર નં. BOB/ADV,તા.07-06-2017 નો સંદર્ભ લુઈએ છીએ જેમાં આપનું એડવાન્સ એકાઉન્ટ ર્શ્ર

નરૂલાલ તુલસીરામજી સુથાર (કરજદાર), શ્રી કિશનલાલ તુલસીરામ સુથાર (સહ-કરજદાર), આપે વિવિધ ક્રેડિટ સુવિધાઓ અને મંજૂરીની શરતોની મંજૂરી આપવામાં આવી છે. ઉપરોક્ત મંજૂરીના અનુસંધાનમાં તમે ધિરાણ

સુવિધાઓનો લાભ લીધો છે અને તેના માટે સુરક્ષા પ્રદાન કર્યા પછી તેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે, જેમ કે પછીથી

જુંુુાવ્યું છે. વિવિધ લોન/ક્રેડિટ ફેસિલિટી ખાતાંઓમાં વર્તમાન બાકી છે અને આવી જવાબદારી માટે બનાવેલ સુરક્ષા હિત

મોર્ટગેજ કરેલ મિલકતની વિગત : તમામ ભાગ અને હિસ્સા સહિત મિલકત, પ્લોટ નં. 93 (કેજેપી પ્રમાણે બ્લોક

નં.31/93) અંદાજીત માપ આશરે 50.14 ચો.મી., "ઉમા વિહાર બંગલોઝ", રેવન્યુ સર્વે નં. 25, બ્લોક નં. 31 ગામ દસ્તાન, તા. પલસાણા, જી. સુરત. કથિત મિલકતની ચતુર્સિમા : પૂર્વ : સોસાયટીનો રસ્તો, પશ્ચિમ

2) તા.07-09-2017 ના રોજના સ્વીકૃતિના પત્રમાં તમે બેંક પ્રત્યે તમારી રૂ.12.25 **લાખ**, તા.07-09-2017ન

રોજ ની જવાબદારી સ્વીકારી છે. ઉપર જણાવેલ બાકી રકમમાં વધુ ડ્રોઇંગે અને તા.11-03-2023 સુધીનું વ્યાજ + તેના પરનું વ્યાજ + વ્યાજ રિવર્સલ, ખાતામાંથી ડેબિટ કરાયેલ અન્ય શુલ્કનો સમાવેશ થાય છે

! જેમ તમે જા<mark>ણો છો, તમે તા.17-06-2022 ના રોજ પૂરા થયેલા મહિના</mark> માટે ઉપરોક્ત લોન/બાકીના વ્યાજની

ચુકવણીમાં ડિફોલ્ટ્સ કુર્યા છે. તમે ટર્મ લોન્/ડિમાન્ડ લોનના હપ્તાઓની ચુકવણીમાં પણ ડિફોલ્ટ થયા છો જે

) તમારા દ્વારા બાકી રકમની ચુકવર્શી કરવામાં કસુર થઈ હોવાથી તમારા લોન એકાઉન્ટ ભારતીય રીઝર્વ બેંકના નિયમો

અને માર્ગદર્શિક પ્રમાણે તા.15-09-2022 (NPA તરીકે વર્ગીકરણની તારીખનો ઉલ્લેખ)ના રોજ નોન પર્ફોર્મીંગ

એસેટ્સ તરીકે જાહેર કરવામાં આવેલ છે. અમારી વારવારની વિનંતીઓ અને માંગણીઓ હોવા છતાં તેના પર વ્યાજ

સહિતની બાકી રકમની ચુકવણી કરી નથી.) ઉપરોક્ત ફકરા 1માં ઉલ્લેખિત વિવિધ સિક્યોરીટીઝ દ્વારા મેળવેલ ક્રેડિટ સુવિધાઓના સંદર્ભમાં તમારી જવાબદારી

પુરી પાડવામાં અસમર્થ નિવજ઼ા હોવાથી અને તમારા એકાઉન્ટના નોન પર્ફોર્મીંગ એસેટ્સ તરીકે વર્ગીકૃત કરવામ આવ્યા હોવાથી અમે અહીં તમને સિક્યુરીટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાઈનાન્સીયલ એસેટ્સ એન્ડ

એન્ફ્રોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ એક્ટ 2002ની કલમ 13ની પેટા કલમ (2) હેઠળ તમને નોટીસ આપીને

ઉપરોક્ત ફકરા 1માં જણાવેલ બેંકની બાકી રકમ રૂા.12,44,000.00 લાખ(રૂપિયા બાર લાખ ચુંમ્માલીસ હજાર પુરા) અને તેના ઉપરનું વ્યાજ +વ્યાજ રિવર્સલ + અન્ય ચાર્જીસ આ નોટીસ પ્રાપ્તીથી 60 દિવસની અંદર ચુકવીને

તમને નાણાકીય જવાબદારીઓ અદા કરવાનું જણાવવામાં આવે છે. અમે તમને વધુમાં નોટીસ આપી જણાવીએ છીએ કે ચુકવણી તારીખ સુધી વ્યાજ સહિતની બાકીની રકમ ચુકવણીમાં કસુર થશે તો ધારાની કલમ 13ની પેટા કલમ 4 હેઠળના તમામ કે કોઈ સત્તાનો ઉપયોગ કરવાની અમને ફરજ પડશે જેની નોંધ લેવા વિનંતી.

) મહેરબાની કરીને નોંધ લેવી કે, પુરી રકમ ચુકવવામાં નહીં આવે તો ત્યાં સુધી દરેક ક્રેડિટ સુવિધા માટે ફકરા-1માં

જણાવ્યા પ્રમાણે દરે વ્યાજ ચઢવાનું ચાલુ રહેશે.) અમે તમારું ધ્યાન આ ધારાની પેટા કલમ 13 તરફ દોરીએ છીએ. જેની પરીભાષાઓ તમારી પર ફકરા-1માં

જણાવેલ વેંચાણ, લીઝ કે અન્ય રીતે સુરક્ષિત નામાંતરણ કરવાનો તમારા પર પ્રતિબંધ મુકવામાં આવે છે (સામાન્ય વ્યવસાય સિવાય). જેના માટે અમારી પૂર્વ મંજૂરી લેવાની રહેશે. વધુમાં એવું જણાવીએ છીએ કે આ

ધારાની કલમ 13(13)માં જણાવ્યા પ્રમાણેની જોગવાઈઓનું પાલન ન કરવું એ આ ધારાની કલમ 29 હેઠળ

દંડનીય અપરાય છે.) અમે તમને જણાવીએ છીએ તમારું ધ્યાન કલમ 13ની પેટા કલમ 8 તરફી દોરીએ છીએ જેમાં સુરક્ષિત મિલકત જે

ટાંચમાં લીધેલી છે તમામ બાકી રકમ, તમામ ખર્ચાઓ સહિત બેંકની બાકી છે તે કોઈપણ સમયે અથવ

જાહેરાતમાં પ્રસિદ્ધ થયેલ તારીખના પહેલા જાહેર હરાજી/ક્વોટેશન મંગાવીને/ટેન્ડર મંગાવીને કે ખાનગી રાહે

સોદો કરીને આવી સુરક્ષિત મિલકત રીડીમ કરાવી શકશે. એ વાતની નોંધ લેશો કે ઉપર મુજબ નોટિસ જાહેર

કૂપા કરીને નોંધ લેશો કે આ નોટીસ કોઈપણ પ્રકારના પુર્વગ્રહ વગર આપવામાં આવેલ છે અને અમારા

ર્બમર્યાદિત અધિકાર કે ઉપાયના માંડવાળ તરીકે ગણવામાં આવશે તેથી આ અંગે વધુ માંગ કરીશું જ્યાં સુધી પુરે

થયાના સુરક્ષિત મિલંકત રીડીમ કરવાનો તમારી પાસે કોઈ અધિકાર રહેશે નહીં.

પુરી રકમ ચુકવાઈન જાય.

સ્થળ : અબ્રામા | તા. 14-03-2023

વ્યાજનો બાકી રકમ તા. 14-03-2022 સિક્યોરિટીઝના ટૂકા અહીં (ના 14-03-2022

..ગ ૨૭૧ તા. 14-03-202 સુધી (તા.11-03-2023 સુધીના વ્યાજ સહિત)

રૂા.12.44 + તેના પર વ્યાજ અને વ્યાજ રિવર્સલ

બોર્ડ ના આદેશ મુજબ

बैंक ऑफ़ बड़ौदा Bank of Baroda ত হা ত ক্রিনি : abrsur@bankofbaroda.com લેણદારને નોટીસ (જે સરફેસી એક્ટ, 2002ના કલમ 13ના પેટા વિભાગ (2) હેઠળ)

સંદર્ભ : અમારી અબ્રામા શાખા, સુરત સાથે ક્રેડિટ સુવિધા.

અમારા મંજૂરી પત્ર નં. B0B/ADV,તા. 27-06-2018 અને BOB/ADV,તા. 27-06-2018નો સંદર્ભ લઈએ છીએ જેમાં આપનું એડવાન્સ એકાઉન્ટ શ્રી રાજેશભાઈ વિનુભાઈ ક્યાદા (કરજદાર), શ્રીમતી નિતાબેન રાજેશભાઈ ક્યાદા અને શ્રી સુભાષભાઈ વિનુભાઈ ક્યાદા (સહ-કરજદાર), આપે વિવિધ ક્રેડિટ સુવિધાઓ અને ાંજૂરીની શરતોની મંજૂરી આપવામાં આવી છે. ઉપરોક્ત મંજૂરીનો અનુસંધાનમાં તમે ધિરાણ સુવિધાઓને અર્ને તેના માટે સુરક્ષા પ્રદાન કર્યા પછી તેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે, જેમ કે પછીથી જણાવ્યું છે. વિવિધ લોન/ક્રેડિટ ફેસિલિટી ખાતાઓમાં વર્તમાન બાકી છે અને આવી જવાબદારી માટે બનાવેલ સુરક્ષા હિત નીચે મુજબ છેઃ

આપેલી સુવિદ્યાનો પ્રકાર	લીમીટ (લાખમાં)	વ્યાજનો દર	બાકા રકમ તા. 14-03-2022 સુધી (તા.11-03-2023 સુધીના વ્યાજ સહિત)	ાસક્યારિટાઝના ટૂકા વર્ણન સાથે સીક્યોરીટી કરાર
બરોડા હોમ લોન 51950600000492	રૂા.19.80	8.70%	રૂા.15.66 + વ્યાજ	જણાવેલ મિલકતનું ઈક્વીટેબલ મોર્ટગેજ, ઈન્સ્ટ્રુમેન્ટ ઓફ ડિપોઝીટ હારા ટાઈટલ ડીડ તા.06–11–2018, વાઈડ ૨જી. ને. 27452
કુલ	રૂા.19.80			સબ રજીસ્ટ્રાર સુરત (કામરેજ), જી.સુરત મોર્ટગેજ કરેલ મિલકતની વિગત નીચે મુજબ
				.

મોર્ટગેજ કરેલ મિલકતની વિગત : તમામ ભાગ અને હિસ્સા સહિત સ્થાવર મિલકત પ્લોટ નં. 55, માપ 66.86 ચો.મી., ''શ્રી શુભ રેસીડેન્સી'', કોમન રસ્તા અને સીઓપીમાં અવિભાજીત પ્રમાણસર હિસ્સાનું માપ 38.83 ચો.મી., બ્લોક નં. 204, રેવન્યુ સર્વે નં. 192/2, ગામ જોખા, તા. કામરેજ, જી. સુરત. કથિત મિલકતની ચતુર્સિમાં : પૂર્વ : પ્લોટ નં.54, પશ્ચિમ: પ્લોટ નં.56, ઉત્તર : લાગુ પ્લોટ નં.42, દક્ષિણ : લાગુ સોસાયટીનો રસ્તો.

+ તેના પરનું વ્યાજ + વ્યાજ રિવર્સલ , ખાતામાંથી ડેબિટ કરાયેલ અન્ય શુલ્કનો સમાવેશ થાય છે જેમ તમે જા<mark>ણો છો, તમે તા.11-08-2022</mark> ના રોજ પૂરા થયેલા મહિના માટે ઉપરોક્ત લોન/બાકીના વ્યાજની ચુકવણીમાં ડિફ્રોલ્ટ્સ કર્યા છે. તમે ટર્મ લોન્/ડિમાન્ડ લોનના હપ્તાઓની ચુકવણીમાં પણ ડિફ્રોલ્ટ થયા છો જે

તા.17-06-2022 અને તે પછી ચૂકવણી માટે બાકી છે. ક) તેમારા દ્વારા બાકી રકમની ચુકવણી કેરવામાં કસુર થઈ હોવાથી તમારા લોન એકાઉન્ટ ભારતીય રીઝર્વ બેંકના નિયમો અને માર્ગદર્શિક પ્રમાણે તા.11-08-2022 (NPA તરીકે વર્ગીકરણની તારીખનો ઉલ્લેખ)ના રોજ નોન પર્ફોર્મીંગ

એસેટ્સ તરીકે જાહેર કરવામાં આવેલ છે. અમારી વારવારની વિનંતીઓ અને માંગણીઓ હોવા છતાં તેના પર વ્યાજ સહિતની બાકી રકમની ચુકવણી કરી નથી.) ઉપરોક્ત ફકરા 1માં ઉલ્લેખિત વિવિધ સિક્યોરીટીઝ દ્વારા મેળવેલ ક્રેડિટ સુવિધાઓના સંદર્ભમાં તમારી જવાબદારી

પુરી પાડવામાં અસમર્થ નિવડ્યા હોવાથી અને તમારા એકાઉન્ટના નોન પર્ફોર્મીંગ એસેટ્સ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હોવાથી અમે અહીં તમને સિક્યુરીટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાઈનાન્સીયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઈન્ટ્રેસ્ટ એક્ટ 2002ની કલમ 13ની પેટા ક્લ્મ (2) હેઠળ તમને નોટીસ આપીન્ ઉપરોક્ત ફકરા 1માં જણાવેલ બેંકની બાકી રકમ રૂા.15,66,000.00લાખ(રૂપિયા પંદર લાખછાંસઠહજાર પુરા) અને તેના ઉપરનું વ્યાજ +વ્યાજ રિવર્સલ + અન્ય ચાર્જીસ આ નોટીસ પ્રાપ્તીથી 60 દિવસની અંદર ચુકવીને તમને નાશાકીય જેવાબંદારીઓ અદા કરવાનું જશાવવામાં આવે છે. અમે તમને વધુમાં નોટીસ આપી જણાવીએ છીએ કે ચુકવણી તારીખ સુધી વ્યાજ સહિતની બાકીની રકમ ચુકવણીમાં કસુર થશે તો ધારાની કલમ 13ની પેટા કલમ 4 હેઠળના તમામ કે કોઈસત્તાનો ઉપયોગ કરવાની અમને ફરજપડશે જેની નોંધ લેવા વિનંતી.

જણાવેલ વેંચાણ, લીઝ કે અન્ય રીતે સુરક્ષિત નામાંતરણ કરવાનો તમારા પર પ્રતિબંધ મુકવામાં આવે છે (સામાન્ય વ્યવસાય સિવાય). જેના માટે અમારી પૂર્વ મંજૂરી લેવાની રહેશે. વધુમાં એવું જણાવીએ છીએ કે આ ધારાની કલમ 13(13)માં જણાવ્યા પ્રમાણેની જોગવાઈઓનું પાલન ન કરવું એ આ ધારાની કલમ 29 હેઠળ

ટાંચમાં લીધેલી છે તમામ બાર્કી રકમ, તમામ ખર્ચાઓ સહિત બેંકની બાકી છે તે કોઈપણ સમયે અથવા જાહેરાતમાં પ્રસિદ્ધ થયેલ તારીખના પહેલા જાહેર હરાજી/ક્વોટેશન મંગાવીને/ટેન્ડર મંગાવીને કે ખાનગી રાહે સોદો કરીને આવી સુરક્ષિત મિલકત રીડીમ કરાવી શકશે. એ વાતની નોંધ લેશો કે ઉપર મુજબ નોટિસ જાહેર

) <mark>તા.</mark>02-07-2018 ના રોજના સ્વીકૃતિના પત્રમાં તમે બેંક પ્રત્યે તમારી <mark>રૂ.19.80લાખ, તા.</mark>02-07-2018ના રોજ ની જવાબદારી સ્વીકારી છે. ઉપર જણાવેલ બાકી **રકમમાં** વધુ ડ્રોઇંગ અને તા.11-03-2023 સુધીનું વ્યાજ

મહેરબાની કરીને નોંધ લેવી કે, પુરી રકમ ચુકવવામાં નહીં આવે તો ત્યાં સુધી દરેક ક્રેડિટ સુવિધા માટે ફકરા-1માં

જણાવ્યા પ્રમાણે દરે વ્યાજ ચઢવાનું ચાલુ રહેશે. અમે તમારું ધ્યાન આ ધારાની પેટા કલમ 13 તરફ દોરીએ છીએ. જેની પરીભાષાઓ તમારી પર ફકરા-1માં

દંડનીય અપરાધ છે.) અમે તમને જણાવીએ છીએ તમારું ધ્યાન કલમ 13ની પેટા કલમ 8 તરફી દોરીએ છીએ જેમાં સુરક્ષિત મિલકત જે અમે તમને જણાવીએ છીએ તમારું ધ્યાન કલમ 13ની પેટા કલમ 8 તરફી દોરીએ છીએ જેમાં સુરક્ષિત મિલકત જે

થયાના સુરક્ષિત મિલકત રીડીમ કરવાનો તમારી પાસે કોઈ અધિકાર રહેશે નહીં. કૃપા કરીને નોંધ લેશો કે આ નોટીસ કોઈપણ પ્રકારના પુર્વગ્રહ વગર આપવામાં આવેલ છે અને અમારા ર્બમર્યાદિત અધિકાર કે ઉપાયના માંડવાળ તરીકે ગણવામાં આવશે તેથી આ અંગે વધુ માંગ કરીશું જ્યાં સુધી પુરે પુરી રકમ ચુકવાઈન જાય.

આપનો વિશ્વાસુ, અધિકૃત અધિકારી. સ્થળ : અબ્રામા | તા. 14-03-2023

PREFERRED NATIONS LOSE EXEMPTION

Impact of angel tax: More startups to set up shop in GIFT City

Bengaluru, May 26

MORE NUMBER OF domestic startups may now start housing their operations within Gujarat International Finance Tec (GIFT) City, rather than their historical preference for locations like Mauritius and Singapore. $According \,to \,venture \,capitalists$ and legal experts, such a move will come about as a result of the government's recent notification, which has not exempted investments from countries like Singapore, the Netherlands, Mauritius and UAE from the angel tax levy. Foreign capital inflow into Indian startups has been growing from these countries in recent times.

The government has, however, exempted foreign funding from 21 countries, including the US, UK and France from the tax levy.

Rajeev Suri, managing partner, Orios Venture Partners said that the new notification will benefit the government in multiple ways, including in the form of forex flows and in widening the income tax net.

"We believe this (exemption of a few countries) expresses the government's intent to promote Gift City as the preferred means to receive foreign funds into India, by explicitly discouraging funds from jurisdictions like Mauritius and Singapore. These countries are preferred loca-



STARTUP HOTSPOT

■ The angel tax which is applicable to startups is essentially a tax levied on the capital raised by a company and was introduced originally in the 2012 Budget

■ Centre's recent notification has not exempted investments from countries like Singapore, the Netherlands, Mauritius and UAE from the angel tax levv

tions historically for structuring feeder funds, because of multiple reasons, including attractive tax rates and light KYC norms," Suri said.

Legal experts also indicated that the explicit exclusion of countries like Singapore, the Netherlands, Mauritius and UAE, from the list may also force foreign investors to adjust valuations to avoid tax, despite having legitimate reasons for a valuation premium.

Armaan Patkar, partner, Argus Partners said that investors from countries such as Singapore and Mauritius may also be forced to seek relief from additional capital gains via India's existing Double Taxation Avoidance Agree ment (DTAA) agreement. The DTAA is an agreement that India had earlier signed with multiple countries to help foreign investors avoid being taxed twice on the same income.

The notification by the Central Board of Direct Taxes also excluded certain classes of investors from the ambit of the angel tax levy. These includes VC funds registered with Sebi as Category-I FPI, Endowment Funds, Pension Funds and broad-based pooled investment vehicles, which are residents of 21 specified nations, including the US, UK, Australia,

Germany, Spain, and others.

EXPLAINER

BEHIND US VISA CURBS ON BANGLADESH

An announcement by a top US government official on Wednesday, regarding certain conditions for denial of visa to Bangladeshi citizens, has sparked debate regarding 'Western interference'. even as it has implications for India's relationship with its eastern neighbour. Here is a look at the matter (compiled from **Bloomberg** and other sources)



The visa controversy

ON WEDNESDAY, US secretary of state Antony Blinken announced that Washington would stop giving visas to Bangladeshi citizens believed to be complicit in interfering in elections, including vote-rigging, intimidation of voters and measures preventing the free dissemination of views. The restrictions will apply to current and former officials, members of progovernment and opposition parties, and members of law enforcement, the judiciary and security services.

The US decision is believed to reflect the fears articulated by Bangladeshi opposition parties regarding the conduct of free and fair elections under the watch of the ruling Awami League government. The US, however, later clarified that the action did not target the Hasina government or her party, the Awami League.

May 3

US decision communicated to bangladesh govt

2018

bangladesh polls marred by Allegations of voter fraud, rigging

2021

US imposes sanctions on B'desh's Rapid Action **Battalion**

May 2023

Rising attacks on press, says **Human Rights Watch**

Opposition fears

THE SOUTH ASIAN country's opposition has raised concerns that Prime Minister Sheikh Hasina and the Awami League could try and rig elections to cling to power as seen over the past decade. Hasina's government has repeatedly denied the allegations. The Bangladesh Nationalist Party, the biggest opposition group, wants Hasina to step down and pave the way for a national vote under a non-partisan caretaker system, saying there shouldn't be a repeat of the 2018 elections with reports of violence, vote fraud and a crackdown on Opposition.

The BNP, as expected, has welcomed the US decision saying 'it was made considering the concern of the people of Bangladesh over the (next general) election' and 'will at least play a supporting role in holding the next polls in a fair and credible manner'.

How the Hasina govt has responded

"THE HOLDING of free and fair elections is the responsibility of everyone voters, political parties, the government, the security forces, civil society, and the media," Blinken had said. "I am announcing this policy to lend our support to all those seeking to advance democracy in Bangladesh." Against this backdrop, Bangladesh's government pledged to ensure free and fair general elections next

Bangladesh views the US decision in the "broader context of its government's unequivocal commitment to holding free and fair elections at all levels for upholding the country's democratic process," the foreign ministry in Dhaka said Thursday. "The government apparatus will take necessary measures to prevent and address any unlawful practices or interference by any individual, group or entity to compromise the smooth and participatory conduct of the elections.'

Souring Bangladesh-US relations, and India

THE US-BANGLADESH relationship has hit sour notes on quite a few occasions in the immediate past. In 2021, the US imposed sanctions on the Rapid Action Battalion that had been accused of having a hand in the forced disappearance of Bangladeshi nationals seen as opposed to the Awami League. There has been so much unease

that Sheikh Hasina even said in the country's Parliament in April that the US was seeking a regimechange in the country, after a US State Department official said that an erosion of democracy in Bangladesh constrained its relationship with the country. Despite the pain points,

Bangladesh can't afford to

damage ties too deep, since the US is key to its trade-led growth path to shed least developed countries status by 2026.

India, which enjoys friendly relations with the US and Hasinaled Bangladesh, will likely keep mum on the issue, though the US stance is clearly aimed at keeping Sheikh Hasina and the Awami

League in check in the upcoming elections. New Delhi though would prefer Hasina back in power in Dhaka, given how the her government has been more than accommodating of its concerns in the neighbourhood, despite the scorn heaped on Bangladeshi migrants in India by many leaders of India's ruling party.

CINERAD COMMUNICATIONS LIMITED CIN: L92100WB1986PLC218825 Subol Dutt Building, 13, Brabourne Road, Kolkata 700 001.
Telephone: +91 33 2231 5686, E-mail: cinerad@responce.in, Website: www.cineradcommu.
STATEMENT OF AUDITED STANDALONE FINANCIAL RESULTS FOR

PARTICULARS	Quarter ended March 31, 2023		Quarter ended March 31, 2022	Year ended March 31, 2023	Year ended March 31, 2022
	(Audited)	(Un-Audited)	(Audited)	(Audited)	(Audited)
Total income from operations (net)	1.376	1.109	1.047	4.962	5.697
Net Profit / (Loss) from ordinary activities after tax	-1.026	-2.155	-2.042	-9.596	-7.696
Net Profit / (Loss) for the period after tax					
(after Extraordinary items)	-1.466	-2.155	-2.213	-10.036	-7.867
Equity Share Capital	520.000	520.000	520.000	520.000	520.000
Reserves (excluding Revaluation Reserve as					
shown in the Balance Sheet of Previous year)	0.000	0.000	0.000	-407.489	-397.454
Earnings Per Share (before extraordinary items)					
(of Rs. 10/- each)					
Basic:	-0.021	-0.041	-0.043	-0.186	-0.151
Diluted:	-0.021	-0.041	-0.043	-0.186	-0.151
Earnings Per Share (after extraordinary items)					
(of Rs. 10/- each)					
Basic:	-0.021	-0.041	-0.043	-0.186	-0.151
Diluted:	-0.021	-0.041	-0.043	-0.186	-0.151
NOTE .					

The above is an extract of the detailed format of Standalone Audited Financial Results for the Quarter and Year ended 31 03 2023 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations Exchange websites

Company's website: http://www.cineradcommunications.com/investor.htm

NOTES:

PARTICULARS

Net Profit / (Loss) from ordinary activities after tax

Reserves (excluding Revaluation Reserve as shown in

Company's website: http://www.thiraniprojects.com/financial-result.php

Company at their respective meetings held on 26th May 2023.

Earnings Per Share (before extraordinary items)

Earnings Per Share (after extraordinary items)

Total income from operations (net)

the Balance Sheet of Previous year)

BSE Limited: www.bseindia.com

(after Extraordinary items) **Equity Share Capital**

(of Rs. 10/- each) Basic

(of Rs. 10/- each)

Basic:

Diluted Note:

Notes:

Place: Kolkata

Net Profit / (Loss) for the period after tax

1) The said financial results were reviewed by the Audit Committee and were thereafter approved by the Board of Directors of the Company at their respective meetings held on 26th May, 2023.

2) In accordance with the requirements under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Statutory Auditors have performed an Audit of the financial results of Cinerad Communications Limited for the guarter and year ended 31st March 2023. There are no qualifications in the Audit report issued for the said period.

> Cinerad Communications Limited Pradeep Kumar Daga

> > (Audited)

78,490

-68.340

-68.340

-0.338

Thirani Projects Limited

Utpal Dey

2021.288

(Audited)

83.551

14.878

14.211

2021.288

-142.173

0.070

0.070

0.070

Director Date : 26th May, 2023 DIN: 00080515

THIRANI PROJECTS LIMITED

CIN: L45209WB1983PLC036538 Regd. Office: Subol Dutt Building, 13, Brabourne Road, Mezzanine Floor, Kolkata 700 001, (W.B.), India Telephone : 033 2231 5686. E-mail : thiraniprojects@gmail.com. Website : www.thiranipro

STATEMENT OF AUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER AND

YEAR ENDED MARCH 31, 2023

(Audited)

-113.481

-113,481

2021.288

-0.561

-0.561

The above is an extract of the detailed format of Financial Results for the Quarter and Year ended 31.03.2023 filed with the Stocl Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results for the Quarter and Year ended 31.03.2022 is available on the Stock Exchange websites

1) The said financial results were reviewed by the Audit Committee and were thereafter approved by the Board of Directors of the

2) In accordance with the requirements under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements

Regulations, 2015, the Statutory Auditors have performed an Audit of the financial results of Thirani Projects Limited for the quarter and year ended 31st March, 2023. There are no qualifications in the Audit report issued for the said period.

3.685

(Un-Audited)

25.054

16.782

16.782

0.000

0.083

0.083

0.083

2021.288

(Audited)

13.380

-37.674

-38.341

2021.288

0.000

-0.190

-0.190

-0.190

BHANDARI HOSIERY EXPORTS LIMITED

Regd. Office: Bhandari House, Village Meharban, Rahon Road, Ludhiana-141007 (Punjab) (India) Ph. 88720-16410, FAX 0161-2690394 CIN: L17115PB1993PLC013930 E-mail: bhandari@bhandariexport.com; web: www.bhandariexport.com STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR QUARTER/YEAR ENDED ON 31.03.2023 (Rs. In Lakhs)

Sr.	Particulars	Quarter	Quarter	Quarter	Year	Year
No		Ended	Ended	Ended	Ended	Ended
		31.03.2023	31.12.2022	31.03.2022	31.03.2023	31.03.2022
1	Total income from operations	11047.65	5590.48	9396.79	28331.13	28343.62
2	Net Profit / (Loss) for the period (before Tax,	237.35	210.21	209.47	789.02	685.01
L	Exceptional and/or Extraordinary items)			00.0000 0000		
3	Net Profit / (Loss) for the period before tax (after	237.35	210.21	209.47	789.02	685.01
L	Extraordinary items)					
4	Net Profit / (Loss) for the period after tax (after	156.98	177.21	195.47	650.64	627.01
١.	Extraordinary items)					
5	Equity Share Capital	1465.27	1465.27	1465.27	1465.27	1465.27
6	Total comprehensive for the period (comprising	(8.95)	-	-	(8.95)	-
L	profit/(loss) after other comprehensive income					
7	Reserves (excluding Revaluation Reserve) as		-	-	7247.02	6690.15
ı	shown in the Audited Balance Sheet of the					
١,	previous year ended 31.03.2022					
8	Earnings Per Share (of Rs. 1/- each)		0.40			0.40
ı	Basic :	0.10	0.12	0.13	0.44	0.43
ı	Diluted :	0.10	0.12	0.13	0.44	0.43
-						

Note: (i) The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual inancial Results are available on the BSE/NSE Website i.e. www.bseindia.com and www.nseindia.com and at Company's Website i.e. www.bhandariexport.com. (ii) The figures of previous have been reclassified and regrouped wherever necessary. (iii) The above stated audited financial results for quarter and year ended 31.03.2023 were reviewed and recommended by Audit Committee in its meeting held on 26.05.2023 the same have been approved and taken on record by Board of Directors in their meeting held on 26.05.2023.

For Bhandari Hosiery Exports Limited

NITIN BHANDAR Chairman & Managing Director (DIN: 01385065)

SHAHLON SILK INDUSTRIES LTD Corporate Office: 3rd Floor, Dawer Chambers, Nr.Sub Jail, Ring Road, SURAT 39500:

CIN: L17120GJ2008PLC053464 Tel no.: +91-261-4190200 Fax No.: +912635550 Website: www.shahlon.com Extract of Standalone Audited Financial Results for the Quarter &

Year ended 31st March2023 Quarter ended Year Ended **Particulars** 31/03/2023 31/12/2022 31/03/2022 31/03/2023 31/03/202 12297.66 5396.90 9513.00 30896.76 31338.21 1 Total income from operations (net) 2 Net Profit / (Loss) for the period 3 Net Profit / (Loss) for the period before tax (after Exceptional items) A Net Profit / (Loss) for the period after tax (after Exceptional items) Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) fo

75.93 59.46 436.02 515.37 575.58 33.53 102.42 210.77 377.77 317.73 the period (after tax) and Other Comprehensive Income (after tax)]
 87.76
 102.42
 242.44
 432.00
 349.40

 1786.05
 1786.05
 1786.05
 1786.05
 1786.05
 6 Equity Share Capital (Face Value Rs.2/- per share) Reserves (excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet of previous year) 7635.23 7235.79 continuing and discontinued operations) Diluted: 0.04

. The above financial results have been reviewed by the Audit Committee and there after approved by the Board of Directors at its meeting held on 26th May, 2023.

The above is an extract of the detailed format of Financial Results for the Quarter and Year ended 31st March, 2023, filed with the stock Exchanges under Regulations 33 of SEBI(Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The Full format of the Financial Results is available on the Stock Exchange website (www.bseindia.com) and on Company's website (www.sbeindia.com).

For Shahlon Silk Industries Ltd. Date: 26-05-2023 By Order of the Board



Dated: 26.05.2023

: Ludhiana

MOHITE INDUSTRIES LTD.

Regd. Office & Works: R. S.No. 347, Ambapwadi Phata, NH-4, Vadgaon, Tal. Hatkanangale, Dist. - Kolhapur - 416 112, Maharashtra. Phone - +91 9623570707, 9922370707, E-mail ID: cs@mohite.com CIN :- L40108MH1990PLC058774

CONSOLIDATED AUDITED FINANCIAL RESULTS FOR THE PERIOD ENDED ON 31ST MARCH, 2023

		CONSOLIDATED						
Sr.	Particulars		Quarter Ended on	Year Ended on				
No.		31/03/2023	31.12.2022	31.03.2022	31.03.2023	31.03.2022		
		Audited	Unaudited	Audited	Audited	Audited		
1	Total Income from Operations	3,097.85	1,208.05	4,651.22	8,666.38	16,082.71		
2	Net Profit / (Loss) for the period	453.26	60.66	346.77	730.04	691.23		
	(Before Tax, Exceptional and/or Extraordinary Items)							
3	Net Profit / (Loss) for the period Before Tax	453.26	60.66	346.77	730.04	691.23		
l	(After Exceptional and/or Extraordinary Items)							
4	Net Profit / (Loss) for the period After Tax	392.35	60.66	322.89	669.13	667.35		
l _	(After Exceptional and/or Extraordinary Items)							
5	Total Comprehensive Income for the period	392.35	60.66	322.89	669.13	667.35		
	[Comprising Profit / (Loss) for the period (After Tax) and							
6	Other Comprehensive Income (After Tax)]	2 000 07	2 000 07	2 000 07	2 000 07	2 000 07		
l °	Paid-up Equity Share Capital [Face Value Per Share Rs. 10/-]	2,009.97	2,009.97	2,009.97	2,009.97	2,009.97		
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the				8,921.07	8,432.34		
l ′	Audited Balance Sheet of the Previous Year	·	_	_	0,921.07	0,432.34		
8	Earnings Per Share (Not Annualised) (Rs.)							
ľ	Basic	1.95	0.30	1.61	3.33	3.32		
	Diluted	1.95	0.30	1.61	3.33	3.32		
$ldsymbol{le}}}}}}}}$,,,,,		0.02		

- 1 The above financial results were reviewed and recommended by the Audit Committee of the Board and approved by the Board of Directors at their meeting held on
- 2 Financial results for all the periods presented have been prepared in accordance with the recognition and measurement principles of Ind AS notified under the Companies (Indian Accounting Standards) Rules, 2015.
- 3 The figures of the quarter ended 31.03.2023 and the quarter ended 31.03.2022 are the balancing figures between the audited figures in respect of the full financial year and the published unaudited year to date figures upto the third quarter of respective financial years which were subject to limited review.
- 4 The Standalone Financial Results reflects following figures for quarter and year ended on 31.03.2023 respectivelya) Turnover of Rs. 2,262.71 lakhs and Rs. 7,061.41 lakhs b) Profit Before Tax Rs. 158.18 lakhs and Rs. 354.18 lakhs
- c) Profit After Tax of Rs.97.27 lakhs and Rs.293.27 lakhs 6 The figures have been re-grouped / re-arranged / reclassified / reworked wherever necessary to conform to the current year accounting treatment. 7 Full format of above extract of Financial Results are being made available under "Investor Relation" link on Company's website at www.mohite.com and also on Stock

For and on behalf of Board of Directors of MOHITE INDUSTRIES LTD.,

SHIVAJI MOHITE MANAGING DIRECTOR



Place: Vadgaon, Kolhapur, Date: 25.05.2023.

Exchange's website at www.bseindia.com.



